

णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स
आयओ गुरुबहु माणो

आयार धारा

पूज्य हरिभद्रसूरि महाराज कृत
धर्मबिन्दु - अणुगार धर्म - पंचम अध्याय
वाचना ५५-५८

प्रियम्

= अवतरणम् =

रितेश सरवैया

अहो ! श्रुतम्

शा बाबुलाल सरेमलजु बेडावाणा

सिद्धायल, हीरा जैन सोसायटी,

साबरमती, अमदावाड-३८०००५

मोबाइल - 94265 85904 / E-mail : ahoshrut.bs@gmail.com

संवत् २०१८

પ્રથમ લિંગ ગ્રંથ - વાચના - પૃ

Anupam

ત્રણ પ્રકારની લિંગા ની વાત ચાલી રહી છે,
અને મુનિચંદ્ર સ્વરી મહારાજ કહે છે....

સેલ્માની પ્રશ્ન :- સાહૈલ્ય આ ત્રણ પ્રકારની
લિંગા તો આપના પત્ની થઈ,
પણ અમે ત્રણ પ્રકારની વહીરાવીએ તો અમારા
પત્ની છું કે

વૈજ્યક્ષીની ઉત્તર :- પ્રશ્ન એ છે, કે મહામા
સ્થિત કોયે ને અમે વહીરા-
વીએ ને લાભ મળે એ બરાબર છે. બરાબર-
ના કોયે, યાકું આહું વત્તુ કોયે, અને અમે
વહીરાવીએ તો અમને હોષ લાગે કે નહિ.
આ પ્રશ્નનું કોઈ છે.

જેન પાળ અમ વાય કે કલાળી
વ્યાકિત અમને હું ના વહીરાયું, ન આપુ, એ
લાવથી જિન શાસનમાં નથી. કોને વંદન કરવા-
ન કરવા, અના માટે શાસનમાં, શાસ્ત્રોમાં,
દળી બધી વાતી કરેલી છે. પણ કોને
વહીરાવયું, ન વહીરાવયું, આના માટે શાસનમાં

ડંઈ જ વાત કરી નથી. અને શામનમાં ત્યાં -
 સુધી કહ્યું કે આંધુવન્તુ હાય અને વાત ઉરહી,
 કોઈ સી રકા વેષધારી હાય એ પાગ તમારા-
 ઘરે આવે, તમે કલ્પના કરો, ઘણી બધી વાર-
 શું થાય છે, અમુક પુવો, અંક ધારા, આનો
 કોઈ આનુસંગિક પદાર્થ હું તમને સમમયુ એ
 વાત કુદી છે, જ્યાં લગવાનનો વેષ દેખાય,
 અને આપણે કુક્યા નથી તો, ખરેખર આપણા
 આત્માની ઘણી ખામી કહેવાય, પાગ અમુક પુવો
 એ રીતે ખરેલા બધા લાવિત થાય છે, કે
 આચાર ચુસ્તતા, કોઈના મારેની કુકલ્પના, અને
 અને બીજી ખરેલા બધા લાવિત થાય કે જે વેષ
 દેખાય તે સહજ બહુમાન પ્રગટ્યું મોઈએ, જે
 ભાવ ઉછળવો મોઈએ, જે અહીંભાવ થવો મોઈએ,
 આજ ભીંમવી મોઈએ, સહજ રીતે હાથ મોડીને
 માથુ નમી જવું મોઈએ, અને બદલે છે તે
 અને તરત વિચાર આવે ત્રિવિલાચારી હશે,
 આ બરાબર તો હશે ને, આમ હશે, તમે હશે,
 તો પછી તમારા ઘરે થાળી પિરમાય ત્યાં પાગ
 એવા સત્તર વિકલ્પો કરો ને. કે લાઈ ઝીર-
 નાખ્યું હશે ભીજનમાં, FOOD POISON થશે,

ગોમ વશો, અપયો વશો, કબજિયાત વશો,
ઉલટી વશો, અડા વશો, શું વશો. આખ-
મીંથીને તમે વ્યાં જમી શાકો છો. અને
ભગવાનના શાસનનો વીધ દેખાય, અને વ્યાં
કુવિકલ્પો કરવા લાગો, તો સમગ્ર ભૂમિ તમે
ફેરાઈ ગયા છો.

એમોહા - વત્તા, અગિળીમ વીસની
વાત તો ફર છે, કોઈ બીમ ધર્મના બાવા મોગી,
વગેરે પગ ફોયે, અને ઘરમાંથી ખાલી ફોયે-
જ્યા ન હે, એ ક્ષાપક એમ નહિ એ માગસ !
એકે ભિખારી પગ એમ ની એમ ના મય,
એકે કુતરા પગ એમ ની એમ જેના ઘરેથી-
ના મય, અને માગસ કહેવાય ! એક ભિખારી
ફોયે છે ની એ પગ કુતરાને ખવડાવતી ફોયે છે.
એરને વહોરાવયું - ન વહોરાવયું અને તો કોઈ
સવાલ જ નથી. હવે બીમ નેબર ની સવાલ
આવી ફે લાઈ એમાં એમની લાભ ફે નહિ ની
તો એકે કુતરાને પગ આપવામાં અનુકંપા
છે, શપ્તા વેદનીય ની બંધ છે, અને
અનુકંપા પુનઃ જિજ્ઞેહિ જ કયાતિ પડિસિદ્ધં ।

કોઈ માનવતાની લાવના વી, વ્યવહાર ની લાવના
 વી, તમે દાન આપું અને જિનિવરો અને
 કદી નિષેધ કર્યો નથી. ફેર સવાસની અકેમ
 મપુક આપું કે લાઈ લાલ શ્રિમાં વધારે
 તી નેરું પાત્ર ઉંચું જોરો લાલ વધારે !
 અને પ્રધાન તો આપણો લાવ છે, જ્યાં -
 લાવ ફેરે જોયો લાલ છે, અને નિશ્ચય ક્રીટર
 ની વાત છે, પાત્ર ઉંચું જોરો લાલ વધારે
 અને વ્યવહાર ક્રીટર ની વાત છે, અને નિશ્ચય
 અને વ્યવહાર નું COMBINATION એ છે,
 કે લાઈ પાત્ર ઉંચું ફેરો તો લાવ સહજ ઉંચો
 જ આવવાનો છે.

ફેરે મહાવીર સ્વામી લગવાન
 પધાર્યા ફેરે, કેવા લાવ આવે છે અને એ
 અપેક્ષાએ વ્યવહાર નય ફેરે કે પાત્ર ઉંચું ફેરે
 જોરો લાવ વધારે, અને મહાવીર સ્વામી
 પધાર્યા ને અભિનવ જોઈ ને કોઈ પડી
 નથી, કદી દીધું કે લાઈ આપ એમ ની,
 જોરો અને માત્ર સોના મહારેની લાલ થયા
 છે, આત્મિક લાલ થયા નથી.

દુષ્ટ તમારા પ્રેરણની નવુક આપું કે અમારા
 ઘરે જે આવે છે, જે કોવા આચાર પાળે છે,
 કોવી પરિભાગિ છે, કોવા ઝોમના લાવ છે, કયું
 ઝોમનું ગુણસ્થાનક છે, કોવી ઝોમની સંયમ-
 સ્થાનની સ્પર્શના છે, જે ખબર નથી, ની
 અમારે કઈ રીતે વહીરાવવું, અને એના
 જવાબમાં આપશ્યક નિર્ધુક્તિ આગમની અંદર
 વંદન નિર્ધુક્તિમાં મુનકોવેલી લ્યક્ષ્ણાદુ સ્થામી
 મહારાજ સ્પાર જવાબ આપે છે.

अपुत्रं दद्रुणं अहमुद्रुणं तु गौर कायवत्
 અમૈ ઉપામયમાં બેઠા હોઈએ, અમૈ સ્વાલ્યાય
 કરી રહ્યા હોઈએ, અને મહાન્ના આલ્યા, ઝોમની
 પ્રવેશ થયા, અમૈ કઈ ઝોમની મેયા નથી, મહ્યા
 નથી, ખબર નથી, કે કોવા આચાર છે, શું
 છે, શું નહિ છે, એમને અમારે બેઠા રહેવાનું,
 જે આવે એટલે અમમ ધુરી ધુરીને મેયા.
 કરવાનું, અને ઝોમને પુઠવાનું કે તમે કોવા
 આચાર પાળો છો કે અથવા તમે કોઈ
 CERTIFICATE લાલ્યા છો કે નહિ, અથવા
 તમારી તપાસ કરાવી રાખશું, બીજી વાર આવમે
 ત્યારે વધાયોગ્ય કરશું, આપુ નથી કરવાનું.

સ્તુતકૃત્રી ભદ્રબાહુ સ્વામી મહારાજ કહે છે કે અપૂર્વ મહાત્મા ચ્યારે પદાર્થ હોય, બધી જ શીતનું અંશિત્ય અમારે અમનું કરવાનું. અમારે અભ્યુત્થાન કરવાનો, અમનો હાંડો લઈ લેવાનો, અમના કપડા સુકવવાના, અમને આભન આપવાનું, અમને બેસવા વિનંતી કરવાની, જ્યાં અપૂર્વ નવા, અપ્રેરિયિત મહાત્મા છે, ત્યાં બધું જ કરવાનું.

આહુષ્ઠિ દ્વિદ્વપૂર્વે જદારિહં જરુઅ જં જીવં ॥

ટ્રીપટ પુર્વ, એટલે કે પરિચિત, આપણે અભીએ છીએ. આપણે અજાણીએ છીએ, એવા મહાત્મા છે. તો પછી અમના માટે જે યોગ્ય હોય એ અમારે કરવું. આવી શાસ્ત્રાજ્ઞા છે. જે મહાત્મા સાથે વ્યહવાર કરાય એવો છે, તો અમે અમને વેદન એ કરવું, ગોચરીનું એ પુઠવું. અમને ધારીડે એ શિથિલાધારી છે, અમની બહી-પ્રવેશી એવું છે, અમની સાથે વ્યહવાર કરવાની ભગવાને ના પાડી. સ્તુતનો વ્યહવાર, શિથિલાધારી વાસે ગાથા લઈએ પ્રાયશ્ચિત આપે, ગાથા આપીએ પ્રાયશ્ચિત આપે. આવા સાધુ-પણાને પ્રાયોગ્ય જે આચારી બતાડ્યા, જે વિધિ-

નિર્ધેય બતાડ્યા, અને અને પરથી તમે તમારા
 માટે સમગ્ર શક્તિ કે તમારે શું કરવાનું. અને
 ગૃહસ્થ ધર્મ છે કે કોઈ પણ ઘરે આવે, અને
 અને અને તો કઠાય જ નહિ, અને ન
 વહીશવવાનો તો સવાલ જ નથી, અને લાલા-
 લાલ ની દ્રષ્ટિએ, જેવું પાત્ર એવો તમને લાભ-
 મળશે.

કૃત્ય વધારે અને સ્વભૂત કરું કે,
 મહાત્મા, થોડું આધુ-વત્તુ હોય, અને તમને
 એવું લાગે કે આ લાભ આપી તો થોડા એવા
 આવ્યા, આવી ગયા છે તો કૃત્ય વધારેથી હઈએ
 તો એ લુભી છે. પાચમા આશ્રમમાં થોડું આધુ-
 વત્તુ, એ લાભ સાધુનું લક્ષણ છે. અપેક્ષિત વાત
 છે. અને થોડું આધુ-વત્તુ હોય એ તો
 બહુ સારું કહેવાય, કે લાભ જે કાળની અંદર-
 દેવાળા નીકળે, જે કાળની અંદર મુકશાની -
 નીકળે, અને અંદર તમે કમાવો કરી, લાભ
 સાધુ જ હોય તો થોડું આધુ-વત્તુ હોય જ
 એવી વાત નથી, આ અપેક્ષિત વાત છે. જેને
 આપણે આધુ-વત્તુ જરાબ કહીએ અથવા બીજા શબ્દો-
 માં, વધારે સારું કહીએ, અપેક્ષાએ ~~કહેવું~~ કહેવાય.

તો આયુ જ્યાં હોયે થોડું ઓછું- વધુ હોયે ,
 વકુલકુસુમોદિતિ તિત્થં

એકવાસ હુઆ વર્ષ લગવાનના તીર્થની પરંપરા,
 બહુસ અને કુશીલ એનો સીધો અર્થ છે,
 થોડું ઓછુંવતુ, એવા સાધુની અપેક્ષા એ પાલવાનું
 હોયે, અને એના ઉપર તમે ચાકડો મારો
 તો તમે શાસન ઉપર જ ચાકડો મારો છે.
 જ્યાં સુધી મહાપ્રતો માં નિધરના છે, જ્યાં સુધી
 મુળ ગુણોમાં કાંઈ ગડબડ નથી, ત્યાં સુધી.
 મહાન્માને લાવ સાધુ સમજ્યા.

ત્યાં સુધી મહાન્માને ગૌતમ સ્વામી સમજ્યા!

ઉછળતા અહોભાવ પુર્વક એમનું બધું જ ઓચિત્ય
 કથ્યું. આ શાસ્ત્રાજ્ઞા, કોઈની કંઈક વિશેષ -
 પણ ગડબડ હોયે, સહભાવ ગુમાવવા નહિ.
 એમનામાં જે ગુણ છે એ ગુણને પ્રધાન કહ્યા,
 કાળ વિષમ છે, ઝૂંત્ર વિષમ છે, પુલો ના દક્ષિ
 વિષમ હોયે, કમ્બો ના ઉદયો વિષમ હોયે, અને
 બને એવું, તમારો સવાલ હોયે છે ત્યાં
 ભાવ કંઈ રીતે દેખાવવા લે

मुनडोवली ल्पद्रोबाहु स्थात्री महाराज, आवश्यक
निर्युक्ति आगत्रां अनी ज्वाप आवी ही,

इमो ०००० चरितं तव विठायं जत्थ जसिर्षं प्रासे ।

ज्यां हर्षानि, ज्ञान, धरित्र, तप अनी विनय -
अं ज्यां जैरुं दीजाय,

जिठापठानं भक्तीं पूयठ तत्थ तं भवं ॥

अं महान्मानी अडोए पाग क्रिया, अडोए पाग
योग, अडोए पाग शुल लाव, अडोए पाग -
शुल परिगति, अंमै तमै नजर सामै राजमै,
तभारा धरै आवै, तभने जजर ह्ये आरला-
आरला हीकी ही, तमै अंमनी ड्या गुग ही
अंमै अंमै. संदलाव टकावमै, गुगनी वंहन
डरमै, निहा, कुयली, यथात्रां पडता नहि, आ
वहोरोपवा संबंधी वात अने वंहनादि संबंधी
ज्यां विशिष्ट शिधिलाचार ह्ये, ज्यां महोप्रती-
ना लंग ह्ये, त्यां ज्युं, त्यां वंहन डरवा,
आनी शास्त्रां निशीध ही, त्यां शु' डरपुं न
डरपुं, त्यां ज्जने तमै पाछा आत्र ठला रधा,
त्यां वंहन डरवा, संघर्षो डरवा, मनहुःप्रो डरवा,
डलीशी डरवा, डक्षयो ना निमित्ती जनै, आवुं -
ना थाय, माहै त्यां मध्यस्थ लाव राजवा.

અને વ્યાં ના જુવું, એટલે આગળનું કાંઈ ઉલુ
 થાય નહિ, પણ આ જુવું અત્યંતિક અને
 અત્યંત એવા હોયે એ સંયોગ ની વાત છે.
 ઉત્તરગુણી ની સ્ખલનાની ખંદર આવા શિષિલા-
 થારીના STAMP લગાડી દેવા, આ ખિલકુલ
 શાસ્ત્ર સંપ્રત નથી, ઉચિત પણ નથી, અને
 આત્મા ના દિત્રાં પણ નથી. આને સમય -
 થયાં છે, આને આરતું રાખીએ.

x x x x

धर्म विंदु ग्रंथ - पाथना-पत्र

Anupam

धर्म विंदु ग्रंथां प्रथम इरीत्यद्र सरीष्यरथु -
 महाशत्रु, पाथना अध्यायथां, अगगार धर्मनी
 धारा आगण लघु कता, नीत्र नोषरनी लीजानी
 वान डरे ही, धृति लीजा. धृति नी अर्थ ही,
 आयुषिका, रीथु, रीथो लीजुं डरे क डरी राड
 अत्रे नथी.

निःस्वा-इन्ध-पञ्जनी ये तु न शक्ता वै क्रियन्तरे ।

रीथो गरीज ही, रीथनी पासो पीसा नथी,
 रीथो पंगु ही, रीथो आंधणा ही, रीथो लीजुं
 डरे डरी शडो अत्रे नथी, नोडरी डरी राडो -
 अत्रे नथी, धंधो डरी राडो अत्रे नथी, डोरे
 पाण प्रडारे रीथो रीजगार, उभागी वगरे डरे
 अत्रे नथी राडो अत्रे नथी.

मिक्षामवन्ति कृत्यर्थं वृत्तिभिस्त्रियमुच्यते ॥

धने धृति लीजा डरेवाय डी रीथो अत्रेनुं पीट
 लरवा मारे, लीथ अंगना डीय, इरीत्यद्र सरी
 महाशत्रु अत्रेड प्रडरगत्रां डरे ही.

नातिदुष्टावि चामीषामेवा स्थान्त इथमी तथा ।

अडे ल्याडिन ही, री शिथिलाथारी ही, वीषधारी
 मात्र ही, यथाशक्ति जिनासा पाण रीथने पाणवी
 नथी, डाणीयित संयत्रथी पाण री अत्रे ही.

એ વ્યક્તિ પાતે ભીજા ચર્ચા કરતી હોયે, એના કરતા એ ભિખારી ભીજ મંગતા હોયે, એ વધારે સારુ. આગળ વધીને સવા સો ગાથાના સ્તવનની અંદર, પૂજ્ય મહીપાધ્યાય યશોવિજય મહારાજ કહે છે,

નિર્દય ઇદય છ કાયત્રાં, જે ભુમિ વેધે પ્રવર્તે

પરકાયના શુભીની યતના નથી, કસેલા નથી, જયભાગની પ્રવૃત્તિ પાગ નથી, અપવાદે પાગ નવું પડે તો કંઈ પડી નથી, બિન-ધાસ્ત ઘામ ઉપર ને થાલી શકી, નિલકારગ કોઈ પાગ એવા પ્રસ, સ્વાપર શુભની વિશદનામાં વર્તે શકી, જેના પરિભામ કડોરે- નકોરે થઈ ગયા હોય,

શુભીયતી ધર્મથી બાહિરા, તે નિર્ધમ ગતિ વર્તે ?

તે શુભસ્થ પાગ નથી, એ સાધુ પાગ નથી, તે એવા નિર્ધન, રંક, ભિખારી જેવા છે. જેઓ પરકાય પ્રત્યે એવી જયભાગની પરિભામ

ધરાવતા નથી. ડેરીલક્ષ્મી મહારાજ ને પ્રજ્ઞ
 ક્યો ડે આ તમે શું બોલો છો, લિખારી-
 લિખારી છે, લિખારી એના કરતા સારા કઈ
 રીતે હોય શકે, એમની પૃતિ લીખા એ-
 પીરૂષક ની લીખા કરતા વધારે સારી કઈ રીતે
 હોય શકે, ડેરીલક્ષ્મી મહારાજ કહે છે કે
 સાડુ તો બી માંથી એકે નથી. પણ હું એમ
 કહી રહ્યા છું,

નાતિદુષ્ટાપિ ચામીષામૈષા ।

બંને ખરાબ છે પણ એમાં લિખારીની લીખા-
 ચર્ચા ઓછી ખરાબ છે. પ્રજ્ઞ ક્યો ડેરીલક્ષ્-
 મી મહારાજ ને ડે આ પણ તમે રીતે ઉપરથી
 કહો છો, એમ ડેરીલક્ષ્મી મહારાજ જવાબ
 આપે છે.

અનુક્રમ્પાનિમિત્ત્વાદ્ધર્મલાઘવકારિણઃ ॥

લિખારી લીખ માંગે એમાં શાસનની અપભ્રાન્તના કે
 ધર્મનું લાઘવ થતું નથી, લિખારી એ લીખ
 માંગવાની પ્રવૃત્તિ કરવી કે ના કરવી એ -
 આપણો વિકલ નથી, પણ એ જ્યારે એ પ્રવૃત્તિ
 કરતા જ હોય ને આપણે આપીએ એકાદ શરેણી,
 જ્યારે આપણી ડેરેણા લાવના સતેજ થાય છે.

અનુકંપા દાનનું નિમિત્ત મળે છે, અને અનુ-
કંપાના નિમિત્ત બનવા રૂપે આપંગા પડે અને
ભિખારી ની ભીંગા ચર્ચા, એ કાંઈક સારા માટે
પાય છે. જ્યાં માત્ર વેધ છે, અને ભીંગા ચર્ચા
છે, ત્યાં ધર્મની અપભ્રાન્ના થતી હોય, તો
એના કરતા વધારે ખરાબ બીનું શું હોય શકે !
મિથ્યામૌજનમ્ ।

ધર્મબિંદુમાં આ સુત્ર દ્વારા હરીબદ્ધચરી મહારાજ-
કહેવા માંગે છે, યા સાચા આવક બની, યા
સાચા સાધુ બની, વચ્ચે ન રહી. ઉપદેશમાલા-
માં ધર્મદાસ ગાળિ મહારાજ બહુ સ્પષ્ટ શબ્દોમાં
કહે છે,

પરિચિંતિતુળ નિતુળં જહ પિયમમરો ન તીરહ વીંદું ।
દીજા લીધા પછી પણ મેં દીજા બરાબર પાળી-
ના શકાય, મહાવ્રતોની સ્ખલના હોય, જિનાજા-
ની પણ એમી તૈમી હોય, બેફામ હોમી -
સંધવાના હોય, નિહકુર પરિભ્રામિ હોય, મહતના-
રોચના ખાવાના હોય, વિશ્વાસઘાત બીચની -
કરવાની હોય, વેધના નામે ચરી ખાવાનું હોય,
તો તમે બહુ સુક્રમ દ્રષ્ટિથી, નિપુણ દ્રષ્ટિથી,
તમે પરિચિંતન કરો, તમે પહિલા નંબરમાં -

સંયમમાં જ આવી, મહાપ્રતોની સ્થિરતા મેળવી,
 જિનાસાની પ્રતિબદ્ધતા મેળવી, યથાશક્તિ -
 આરાધના મેળવી, અનંત કાળે મળેલું આ
 સંયમ આને ગુમાવી દેવા જેવું બિલકુલ નથી.
 પણ એ CONCLUSION એ જ છે કે તમારાથી
 શક્ય જ નથી, અથવા શક્ય હોયો છતા -
 તમારે કરવું જ નથી. અને હૈકામ તમારે
 સાધુ વૈષ્ણવી ગૌરલાલ ઉઠાવવી છે, અને
 શાસન અપભ્રાજના જ કરવી છે,

મુત્તૂળ તો તિમ્મી મુસાગતં વરતરાગં ।।

તો પછી BETTER છે, એ ત્રિલુપ્તિ, અરેલ
 કે દીગા લુપ્તિ, જનમ લુપ્તિ, અને વિચરણ લુપ્તિ,
 આ ત્રણ લુપ્તિને હોડી ને, તમે સદ્ગૃહસ્થ -
 શુભાવક બનીને તમારું પુવન પુવવાનું શરૂ કરી
 હો. ધર્મદાસ ગણિ મહારાજ ને કહ્યું કે આ -
 તમે શું બોલો છો તે આણું ને કાંઈ બોલતું
 હશે દીગા હોડવાની તમે વાત કરો છો. અને
 ધર્મદાસ ગણિ મહારાજ જવાબ આપે છે,

અરિહંતચૈદ્યાગં મુસાહુપૂચારમ્બી દઢાચારી ।

એ પ્રાવક કે ને અરિહંતની પુમ્બ કરે છે,
 શુપાત્ર હાન આપે છે, દેશ વિરતિના આચારોને

પાળવામાં પ્રેર છે

અસ્વાસ્થ્ય વચ્ચે જ આહુર્વસ્થેણ ચુઅધર્મો ॥

એ સાવક વધારે સારા છે, પણ સાધુના વેષમાં ધર્મ પ્રગટ હોય, એ સારા નથી. ~~કોઈ~~ પ્રકારની મહારાજ કહે છે,

~~વિશેષ વિચારણા~~

ગાંધી રીતે ભીખાની શુદ્ધિ, અપેક્ષાએ મન, વચન, કાયાથી, અપેક્ષાએ કર્મ, કરાવળ, અનુભવેથી, અપેક્ષાએ આહાર, ઉપધિ અને શીયા એટલે કે મકાન, આમાં વધારાકરિની કાળે, જે શક્ય હોય, જે કામમાં જે શક્ય હોય, અમાં નિર્હોષતા મળવથી, શુદ્ધિ મળવથી, આ સાધુ પાળાનું એક બહુ જ મહત્વનું અંગ છે. પુષ્પમાલામાં મલધારી હિમચંદ્રસરી-મહારાજ કહે છે,

जिणस्वामणस्स मूलं भिक्षुखयशिया जिणोहि पणता ॥
निनशासननुं કોઈ મુળ હોય તો એ અપેક્ષાએ ભીખા અર્થ છે. નિર્હોષ શુભ, નિર્હોષ શુભીકા, જેને, હસવેડાલિક સુત્રની અંદર,

મુદ્ધાજીવિતા

કહે, ભાવ હોષ શુદ્ધા નથી, એક વ્યક્તિને

બહુ પંપાળી ને રાખી છે, પાળીને રાખી છે,
 વખાળ કરીને રાખી છે, એના ઘરે હું ગાયેરી
 ખાસ જાણ અને એ મને વિશેષ ભક્તિથી -
 વફોરાયે, તો એ મિહોષ હોયો હતા. સુક્રમ-
 હોષ યુક્ત છે, દસવીકાલિક સુખ એવું પગ-
 લેવાની મા પાડે છે.

પ્રેમ્ય હોષ અને ભાવ હોષથી -
 મુક્ત, આવી જેઆ લીઆ છે, ત્યાં સાધુ-
 પગાની નિર્મળતા છે. અથવા કાળોચિત, અંગો-
 ચિત, હોષો ન છુટકો જે લાગે એવો જ છે,
 એટલા બાદ કરીએ ને યથાશક્તિ જયગા છે,
 તો એ અપેક્ષાએ મિહોષ લીઆયર્થા છે. જ્યાં
 કાળોચિત યતના પગ નથી, જ્યાં એ પરિભ્રમણ
 નથી, જ્યાં એવી પ્રયાસ નથી, અને લીઆ-
 એક ઉદાહરણ છે એવી કોઈ પણ સાધુ ચર્ચા
 એની અંદર એ જિનાજ્ઞાની પ્રતિબલ્લતા,
 ઉત્સર્ગ માર્ગ નો ભાવ, અપવાદ માર્ગ સેવવાનો
 ડંખ, એક પરિતાપ, હોવરે ખાલોચના પ્રારા
 એની શુદ્ધિ. એવી કોઈ મિષ્ટક્રમતા પગ ખાવી
 ગઈ તો પગ એની પગ શુદ્ધિ. એ પગ-

નથી, એ જોક્ષાત્ર જ્યાં વેણ નું ગુમાન હોય,
શાસનની વિશ્વાસઘાત જ હોય, તો અધ્યા-
સાધુપાગા કરતા તો શ્રાવક પણ જ સારું.

રીભદ્રસૂરી મહારાજ આગળ -
વધી છે, સુખ નંબર ત્રી,

આઘાતાધિકૃષ્ટિ: ।

આઘાત ની અર્થ શું છે મુનિચંદ્ર સૂરી મહારાજ
સ્પષ્ટ કરે છે, જ્યાં કતલખાનું હોય, જ્યાં
મરનની દુકાન હોય, જ્યાં મરહીમારી હોય,
જ્યાં માહતાના ઢગલા હોય, આદિથી શું
લેવાનું મુનિચંદ્ર સૂરી મહારાજ ને પુછ્યું, એ
કહે છે કે જ્યાં જુગાર રમાતો હોય, જ્યાં
અધ્યા દુર્જન લોકો વધારે હોય, કોઈ દારૂનું
પીકું હોય, કયાંક કોઈક વેચ્યા વગરે ના
આવાસો હોય, આવી બધી જ્યાં જગ્યા હોય,
ત્યાં સાધુઓ જ્યુ તો નહિ, અધ્યા જે જગ્યા
હોય, ત્યાં દ્રષ્ટિ સુધ્ધા પડે, અધ્યા પરિસ્થિતિ-
માં રહેવું નહિ. દસવૈકાલિક ખાગમની અંદર,
પાંચમા અધ્યાયની અંદર, સાધુઓ કઈ રીતે
ગાયરી ચર્ચા કરવી, અધ્યા વાત કરેલી છે,

અને અંતે બહુ સ્પષ્ટ કહ્યું,
વજ્જક વેશ્યામંતે ।

જ્યાં વેશ્યાના આવાસ હયિ, જ્યાં અંબા કાઈ
પ્રેશ્યો, જ્યાં અંબા કાઈ પ્રેશ્યો, જ્યાં અંબા
કાઈ પ્રવૃત્તિ, જે મહા આશ્મવ રૂપ હયિ, કનલ-
ખાનુ મહાઆશ્મવ કહીવાય, વેશ્યા વગરેના સ્થાન
મહાઆશ્મવ કહીવાય, જુગારી વગરેના અહા -
મહાઆશ્મવ કહીવાય, જ્યાં આવી કાઈ પગ પ્રવૃત્તિ
પત્ની હયિ, અંબા જ્યાં સાધુએ જ્યું નહિ,
અંબા જ્યાં મેંથી સુદધા નહિ. પ્રેશ્ય ક્યાં -
દસ વીકાલિક આગ્રમમાં કે બાઈ, આરલા બધા
હીલા છે સાધુ, ગૃહસ્થો પગ બિનધાસ્ત બધે
જતા હયિ છે, આરલા બધા હીલાને, આરલી,
બધી બ્રહ્મચર્યની વાડને આરલી બધી શિખાત્રણ,
અને સાધુ જ ના કહીવાય જેને આરલી બધી
શિખાત્રણો આપવી પડી. આરલુ બધુ સાથવવાનું
ત્યાંથી જતા રહ્યા કે પાકડ થયા અંતે શું માર્યો
ફરક પડી ગયો, નજર પડી ગઈ તો શું ફરક
પડી ગયો, કાઈ બકરાને કસાઈ કાપી રહ્યો છેને
સાધુએ મેંથી લીધું તો અંતે પાપ લાગી ગયું
સાધુને, મુનકેપલી સ્વયંભવસૂરી મહારાજ,

દસવીકાલિક અભાગમાં આ સવાલ ની જવાબ આપી છે,

અગાથળે ચરંતરૂચ સંસ્કૃતિ અભિક્ષણં ।
 જે સાધુ અનાયતનમાં પોને ત્રમભા કરે, ફરે,
 વ્યાં ભીજા ચર્ચા કરે, અને વ્યાં વારંવાર -
 એવી સંસર્ગ થાય,

હુજ્જા વચાળે પીલા સ્નામળામ્મિ અ સંસ્કૃતિ ॥
 તી એમની પ્રતીતી પીડા થાય, એમના પ્રતી
 પીડાય, પ્રતીતી પરિહાતિ પીડાય, જ્યગાની -
 પ્રપૃત્તિ પીડાય, અને શ્રામભયમાં મહાત્માને -
 સંસાય થાય, સાધુ પળું પાળવામાં, નિર્મળ -
 પાળવામાં મન ફાલક ફાલક થાય. આને એયું
 ગાયનું ગણુ કપાયું, આ... ફા... થઈ ગયું -
 એકદમ, આ ક્યાં આવી ગયા, આવાનું ના -
 ભાવ્યું, આયુ થઈ ગયું. આપતી ફાલી પળ એયુ
 થયું પળ થાઈું આઈું, પરમ દિવસી એનાપી -
 આઈું, મહિના સુધી આયુ એતા. એતા, એતા -
 એતા -- એતા, માગમ દેવાઈ અથ, અને એ
 જ્યારે દેવાઈ અથ એની અર્થ છે, એમું એતર -
 નિષ્કુર બની ગયું, અને એ મહાત્માનું એતર
 આ રીતે નિષ્કુર બની અથ, તી પછી એ

સંયમનું પાલન કોપી રીતે કરશે, ખંડકાળના શ્રુતિ પ્રત્યે અત્યંત કોમળ લાવ, આ જ સંયમ છે. બહુ શુભલક્ષ્યા ના નામ પાળ કલ્પનાનાની કિલ્મી જતાવી રાખવી, અને બહુ મોંચે રાખવી, આ બરાબર નથી. આજે લાગણીઓ ઉચ્ચકોણમાં આવી, એના દ્વારા FUND મેળવવામાં આવ્યું, એનાથી કોઈ કાર્ય કરવામાં આવ્યું, પણ આ ઉચ્ચકોણ -- ઉચ્ચકોણ -- ઉચ્ચકોણ -- ઉચ્ચકોણ -- ઉચ્ચકોણની પછી એટલામાં લાગણી ઉચ્ચકોણ નહિ શકાય, પછી આરંભ લેવામાં હિંસા જતાડશે તો જ એમને કાંઈક લાવ મગશે, નો એનું અંતર દ્રવ્યોને પછી આરંભ હિંસા, આરંભ હિંસા, વધારે કાલિલ, વધારે ખરાબ, માનસ બેલાન થઈ જાય. પછી એનું જતાડવું પડશે તો એ લાનમાં આવશે.

એને બ્રહ્મચર્ય જ પાળવું છે એ શા માટે એવા વિસ્તારમાં જાય, જેને નિર્મળ સંયમ પાળવું હોય, એને બને ત્યાં સુધી શહેરી વિસ્તારમાં, સાંતના વિહારો ના કરવા મોંચે જેને નિર્મળ સંયમ પાળવું હોય, એને બહુ એવા HI-FI AREA જ્યાં વસ્ત્ર પ્રયાદા હ્યુ-

નીચે હોય, બહુ ચોક્કસ શબ્દોમાં તમને કહું, પુરવઠાની અંદર જે કપડાઓ વેચાઓ પરિતી ન હતી, અને કમ સે કમ અકાદ પણ કોઈ બીજી વ્યક્તિ, જે એના ઇંધામાં આવેલી નથી, એથી વ્યક્તિ સામે તો ન હતી જ પરિતી. એવા કપડા, ઘરે ઘરે પરિતતા થઈ ગયા હોય, એ સૌ કોઈને સંયમ અનુકૂળ કરી શકે કહીવાય છે.

સેવાનો પ્રશ્ન :- સાંજે વિહાર કરવામાં એવો શું વાંધો છે છે.

પૂજ્યશ્રીના ઉત્તર :- સાંજે લોકોની અવરજવર - વધારે હોય, અને વર્તમાન કાળની અંદર, સાંજના વિહાર કરવામાં આવે, તો એ વધારે અવરજવરમાં, વધારે લોકો, અને કપડા તો જે છે એ જ રહીવાના, અને એનાથી સાધુના સંયમમાં, ક્યાંક સુક્રમ પણ વિદ્યુ ઉભુ થાય, મારે વડિલી એવા વિહારી કરવાની ના પાડી, બને ત્યાં સુધી ની વાત છે. આવી કોઈ કાયદો નથી, ના જ કરવા. અને જે સમજ આવું માનતા હોય કે ન કરવા, આવું બને કે એને

વિહાર કરવાની ફરજ પાગ પડે, પાગ જ્યાં વાતાવરણ
જ અર્ધું છે, જ્યાં રસ્તા જ અધી છે, જ્યાં
બચ્ચર જ અધી છે, જ્યાં પ્રેશર જ અર્ધું છે,
ત્યાં સંયત્રને મેખત્રમાં મુકવા માટે શા માટે જ્યું ?

વેનાધુના પડે પાગ સત્રજવા જેવું છે.
તમારા પડે પાગ, આ એક ઉદાહરણ છે, તમને
બધી ખબર છે. આ વેથાના વિસ્તારો કે-
સાંજના વિહારો, બચ્ચરો કરતા વધારે અનિબરનો
તમે ખીસ્સામાં લઈને બેઠા છો. અને જ્યારે -
આટલી સુક્રમ કાળવ્ય, પામેલા, ગીતાર્થ સંવિગ્ન
મહાત્મા માટે પ્રેર લીરાંગી માટે પાગ, વીાસ્ત્રઠાર
લગાવંતો મે લેતા ફીયે, તો તમારા જેવા એ
ફેરલી કાળવ્ય રાખવાની જરૂર છે એ વિહારમી.
આરે સત્રય વધી છે, આરે આરલું રાખીએ.

x x x x x

દર્મ બિંદુ ગ્રંથ - વાચના પુસ્તક

Anupam

અભ્યાસો ચરંતસ્સ સંસંગાદુ કમિક્ષણાં ।
 દુજ્જા વચાણં પ્રીત્તા સામૃદ્ધિમિ અ સંસઓ ॥
 જે અભ્યાસલભ - સંયમ મારે જોખમ
 એવા સ્થાનોમાં વ્યવસ્થા/વિશિષ્ટતા કરે,
 તે વાસ્તવ્ય કુસંસર્ગ પામે
 તેના તેના પ્રતોનો શુદ્ધિ કહોલાઈ જાય
 તેને ખોતાને કે બાજને પ્રામદ્યમાં સંશય થાય .

જ્યાં પ્રેમણ વિષય-વૃત્તિના મગી શકી એવા સ્થાન
 એવા દ્રુષ્ટિપાત, આ બધાની ઠાણુ પુર્વક ત્યાગ
 કરવા એઈએ. દલીલ એ વાય કે આવી બધી
 ઠાણુ, ઠીલારા એ નબળાઈ નું પ્રતિક છે.
 વિપરીત, પ્રતિકુળ વાતાવરણ ની અંદર પણ તમને
 સ્થિર રહી, અપ્રાં તમને નિર્મળ રહી, એમાં -
 તમારી પરિભ્રમિ સાચવી, તો તમને ખરા સાધુ
 કહેવાય.

શીક્ષકાર ભાવંતી જવાબ આપે છે,
 મજ્જઠિર્દ્ધ પુણ કસા અણુસંગેયં દલ્લિતિ ગુણદૈસા ।
 મધ્યમ થુવા, ઉત્તર થુવા, અને અધ્યમ થુવા-
 ત્રણ પ્રકારના થુવા છે. અપ્રાં માત્ર મધ્યમ થુવા-

ની એ સ્થિતિ છે, કે એમની સંસર્ગથી, સંપર્કથી
ગુણ કે દોષ લાગે છે.

અભિક્ષુપ્તવ્યાપાવા અણુસંગેણં ન ધેષ્યંતિ ॥

જે ઉલ્કાષ્ટ પુલ્કશાળી હોય, અત્યંત પવિત્ર હોય -
સ્થુલભદ્ર સ્થાત્રી હોવા, અત્યંત પાપી હોય. કાલ-
સૌકરીક કસાઈ હોવા, તેમની અણુસંગ, સંસર્ગ,
સંપર્ક, વાતાવરણ એમી કોઈ અસર થતી નથી.
સ્થુલભદ્ર સ્થાત્રીને કોશી વેશ્યા, ના ઘરે પળી
વાંધી ન હતી આવ્યા. કાલસૌકરીક ને મહાવીર-
સ્થાત્રી લગવાનના સત્રવસરગમાં જવા હતાં કોઈ
ક્રાયદી ન હતી થયા. એક અત્યંત પવિત્ર હતા,
એક અત્યંત પાપી હતા. મહુદ અંશી ચુવા ક્યા-
હોય છે તે તો મધ્યમ ચુવા હોય છે. કાર્થિક-
વિરલા ચુવ હોય છે જે અત્યંત પવિત્ર હોય છે,
વિરલા ચુવ હોય છે જે અત્યંત પાપી હોય છે.
અત્યંત ભારે કર્મ. મોટે ભાગે અને વિશેષ કરીને
સાધનામાં આવેલ ચુવા, સંયમ લેનાર ચુવા, શાસન-
માં આવેલા ચુવા, કંઈક સૌથી વધી આરાધના
કરતા ચુવા, એ મધ્યમ હોય છે, અને એમના
ઉપર વાતાવરણની, સંપર્કની, સંસર્ગની પ્રાયઃ કરીને
અસર થયા વગર રહેતી નથી.

મારે મારી પરિભાતિ સાચવવી છે તો પહિલા મારે
 મારી ખાંખ સાચવવાની છે. મારે મારા કાન
 સાચવવાના છે, મારે મારા પગ સાચવવાના છે.
 અને હું મેં કોઈ એવા નિમિત્તો નું સેવન કરું
 છું. તો પછી હું જ મારી પરિભાતિનો વુગાર
 રખું છું. અને મારી પરિભાતિ ટકવાની નથી.
 મારે બંદિર્ભુતિ જ્યું છે, જે રસ્તા છે, એકે રસ્તે
 બચ્ચર આવે છે, લોકો આવે છે, વિમતીય ના-
 દર્શન થાય એવું છે. બીજે રસ્તે છે, કદાચ-
 બે મિનિટ ફરીને જ્યું પડે એવું છે. પગ આવું
 કરું પગ એ રસ્તે આવતુ નથી. હું ગમે તરલા
 પવિત્ર ફોઈ, શાની ફોઈ, કે સચમી પગ ફોઈ,
 હું મેં મેખમ લઉં છું તો મારા ગુણો તાન્વિક
 નથી. અને કદાચ તાન્વિક છે, તો એ ગુણો
 ટકશે નહિ.

પરિભાતિ એ ત્રિયનું વાસણ છે !

પરિભાતિ એ એકે એત્યંત નાજુક પદાર્થ છે !

એની ઘડાતા .. ઘડાતા .. ઘડાતા .. વધી નીકળી જાય છે.

અને જેને ભાંગીને લુકકો થતા એક કાચી સેકેન્ડની પાગ વાર લાગતી નથી.

અનાધાતાંદ્યદૃષ્ટિ: ।

નિશિષ્ય આગમ સુત્રની અંદર સાધુઓ ક્યાં - ઉતરણું, ન ઉતરણું, એના માટે ઘણી બધી પ્રશ્નપૂછાઓ કરી. ભરબર હોયે, ત્યાં જ હોયે - ઉપાસ્ય, એમાં પાગ વિરોધ કરીને સાધુઓ - ભગવંતી, ત્યાં ઉતરવાની સાફ ના પાડી. શબ્દ - પ્રતિબદ્ધ વસ્તિ, જ્યાં વિભતીય ના શબ્દો સંભળાય દેખાય નહિ પણ શબ્દો સંભળાય સાફ ના પાડી. રૂપ પ્રતિબદ્ધ વસ્તિ, જ્યાંથી વિભતીય દેખાય - શકે બહાર ક્યાંક, અંદર રહી એવી વાત નથી. બહાર ક્યાંક દેખાય, એમાં ઉતરવાની સાફ ના - પાડી. હરીભક્ત સૂરી મહારાજ કહેવા માંગે છે, જ્યાં વ્યહવાર શુદ્ધિ છે, ત્યાં નિશ્ચય શુદ્ધિના સંભવ છે. જ્યાં વ્યહવાર શુદ્ધિ જ નથી, જ્યાં આચાર ના પાલનની કાળજી નથી, જ્યાં સ્થાન શુદ્ધિ નથી, જ્યાં ગમન શુદ્ધિ નથી, ક્યાં જ્યુ - ક્યાં ના જ્યુ, આ બધી શુદ્ધિ નથી, ત્યાં ભાવ શુદ્ધિ રહી, એ લગભગ શક્ય નથી. અને લગભગ શબ્દ એવા અત્યંત પવિત્ર -

વિરલા આત્માઓની અપેક્ષાએ, અને મધ્યમ -
 થુવાની અપેક્ષાએ કહીએ તો, લગભગ શબ્દ
 કાઠી નાખવા પડે અને જે એનું સંવેન કરે-
 એમાં શુદ્ધિ રહે એવી કોઈ શક્યતા જ નથી.

દુષ્ટિ વિષયેટર રાખવું છે, હાપુ,
 હૃદય તમારે બંધે કરવું નથી, હૃદય એવા સાધના
 રાખવા જે એક સેકન્ડમાં દુનિયાના ખરાબમાં
 ખરાબ વેશ્યો બતાડી શકે, હૃદય તમારે એવા-
 નિમિત્તોના સામે યાત્રીને સંવેન કરવા છે.
 અને તમે કેવિયાદ કરો કે સાફેલ ખાવા આવા-
 પાપો થઈ શકે છે. હૃદય આપુ છે, હૃદય અમારી
 ખાત્રી છે, હૃદય મનને મનાવીએ, હૃદય તમારી
 પકડેલી રસ્તો પાલ ખાંટો છે. તમારે નિમિત્તોની
 વચ્ચે રહેને, નિમિત્તોના સંવેન કરીને, મોખમ
 લઈએ, શુદ્ધિ ટકાવી રાખવી છે, અથવા પામવી
 છે, આ બધા શોખવિલ્લીના સપના છે. જ્યાં
 સુધી નિમિત્તો નથી ગયા, ત્યાં સુધી નિમિત્તનો
 અસર જતી રહે, આ એક ફાકો છે કે હું -
 પાલ સ્પુલભદ્ર સ્થાત્રી બની શકું એમ છું. હું
 નિમિત્તોની વચ્ચે પાલ શુદ્ધ રહી શકું એમ છું.

સેલાની પ્રશ્ન :- તી પછી સ્થુલભદ્ર સ્વામી
કઈ રીતે નિર્ભય કર્યો હશે કે
કોશા વેશ્યા ને વ્યાં મને વાંધો નહિ આવી.

પ્રજ્ઞાનીનો ઉત્તર :- સ્થુલભદ્ર સ્વામી સ્વામી સ્વામી
નિર્ભય કર્યો જ નથી, સ્થુલ-
ભદ્ર સ્વામી સ્વામી ગુરુ મહારાજ પાસે રમ માંગી છે.
નિર્ભય ગુરુ મહારાજ નો હતો. શ્રુતીપથોગ -
પુર્વક નો હતો, અનિશ્ચય શ્રુતના સ્વામી એમના
ગુરુ હતા. એમનો શ્રુતજ્ઞાનમાં એવું કે આમને
કોઈ વાંધો આવવાનો નથી. ઉપરથી અમિના જે
ગુણો છે એ વધારે નિર્મળ થવાના છે. બીજા
આત્માને લાભ થવાનો છે. પરિભ્રમણે જિન-
શાસનની પાળ પ્રભાવના થવાની છે. આ વધા
લાભો એમને ગુરુએ એ અનુજ્ઞા આપી છે.

નિમિત્તો ની હોડો !

નિમિત્તો ની વચ્ચે રહીને પવિત્ર રહેવા માટે કરતા
લાભ સંઘર્ષો કરતા પાળ નિમિત્તો ની લાભ મારીને
કાઠી મુકવાનો એકે જાનો પુરુષાર્થ, એ આત્માને

વધારે ફાયદો કરવી આપવાનો છે. એ લાખ - સંઘર્ષો નું પરિભ્રમ સંકુળતા છે કે નિબંધનતા છે એ ભગવાન મળી. પ્રાયઃ કરીને નિબંધનતા છે. ફાયદો કરીને વહીવેલી નિબંધનતા છે. ભગવાન જ્યારે કહી છે કે લાઈ નિમિત્ત સાથ તમારા સંસર્ગ ની અસર તમારા ઉપર ના - થાય, એ અશક્ય પ્રાયઃ છે ને છતાં નિમિત્તનું સૈવન ચાલુ રાખવું, એનો સંસર્ગ ચાલુ રાખવો, આ શરૂઆત જ એવી થઈ મય છે, જેમાં ભગવાનની આજ્ઞા નો પાલન ભંગ છે, ઉઘો રસ્તો પકડીએ છીએ, અને એ રસ્તો આપણું મુકામ કદી આપવું જ નથી.

દેવીલક્ષ્મી મહારાજ આજ્ઞા વધે છે
 સુત્ર નંબર થી ૯,
 તત્કથાઽશ્રવણમ ।

સુત્ર નંબર ત્રીવે હું,
 આઘાતાદૃષ્ટિઃ ।

જ્યાં પ્રદેશની વિરાધના, વૈધેયિક નૃભંગા મળી
 એવા નિમિત્તી, એવા પ્રથમો, પ્રવાગ, એવી -
 જગ્યાએ જવું નહિ, એવી જગ્યાને મેવી નહિ,

ત્યાં પ્રેરિતપાત સુધ્ધા ના કરવાં. ચીદિત્રા સુનમ્માં
 દેરીભદ્રસરી મહારાજ એનાથી આગળની વાત કરેછે,
 તત્કથાઽશ્રવણમ્ ।

એવા સ્થાનની વાત સુધ્ધા સાંભળવી નહિ.
 કોઈક સાધુ પાસે આવી ને બેસે છે ને વાત-
 કરે છે, કે ક્ષમાળી કંપનીએ અહિંયા મારો
 PLANT નાખ્યો છે ને આવી MACHINERY
 છે ને આવી વ્યાં આખી SYSTEM છે ને,
 અને મિનિરની અંદર આરબુ PRODUCTION
 વાચ અટલી નાકાત છે ને હું એવા ગયાં -
 દેનાં ને ઘાડ.. ઘાડ.. ઘાડ.. ઘાડ.. ઘાડ.. ઘાડ..
 ઘાડ.. બધું PRODUCTION થતું જ અય.
 હવે વાત શરૂ થતી હોયે વ્યાં સાધુની ક્ષરજ છે
 કોઈપું, કે આ સાંભળયું મને કલ્પતુ નથી.
 તત્કથાઽશ્રવણમ્ ।

કોઈક સાધુ પાસે આવે છે ને વાત કરે છે
 કે આનુ આની સાથે ગાઠિવાયું છે ને છોકરી
 પણ સારી છે ને આ પરિવારની છે અને
 અનેની FACE ને એ બધું પણ આણુ છે.
 હવે કોઈક વાત શરૂ થઈ છે ને સાધુ ફટ લઈને
 કહી દે કે મને આ સાંભળયું કલ્પતુ નથી.

કોઈક સાધુ પાસે આવે છે ની કહી છે, કે
 અત્યારે આવા નવા-નવા TAXES લાગ્યા છે,
 બચ્ચરની અંદર આવી પરિસ્થિતિ છે, આવી
 STRIKE કરી છે. અથવા બચ્ચરમાં ત્રણ છે,
 અથવા મંદી છે. અથવા આ કંપનીઓ આયુ-
 સકોલો કર્યું છે, અથવા શરિબચ્ચર અત્યારે અહીં
 પહોંચ્યું, આમ પહોંચ્યું,

તત્કથાશ્રવણમ્ ।

સાધુએ એને ON THE SPOT કહી દેયું પડે, કે
 આ બધું સાંભળ્યું મને કલ્પતું નથી. આચાર્યો
 સુમતી અંદર એકે દાટના બતાડી, મહાત્મા-
 વિહાર કરીને એકે ગામમાં આવ્યા છે, યોગ્ય-
 વસ્તિને શોધી રહ્યા છે. વસ્તિ એટલે મકાન.
 તમારી લાખમાં ઉપામય. અમારી લાખમાં
 નિર્દોષ એવું મકાન. જે સાધુને ઉતરવા માટે
 કલ્પી શકે, સંસ્કૃત શબ્દ કોષની અપેક્ષાએ
 વસ્તિનો સીધો અર્થ છે મકાન. મહાત્મા-
 મોઈ રહ્યા છે કે કયું મકાન SUITABLE
 છે, સાધુ માટે. અને કયાં આપણે રહીએ-
 નાં સંયમ યુદ્ધિ સથવાય. અમુક મકાન-
 યાંથી સ્ત્રીના શબ્દો સંભળાય, સાધુ યાંકો મારે

હો. ક્યાંક દર્શન થઈ શકે, દેખાય શકે એનું સ્વેપ
 વિભ્રતીય દેખાય, ચોકડો લગાડે છે. ક્યાંક એ
 વસ્તિના આગલા ભાગમાં જ બધી મોકાઈ વગેરે
 ની દુકાનો છે, જેની સુગંધ આવતી ફીચે ની-
 આવતા જતા દેખાતુ ફીચે, મહાન્મા ચોકડો મારે છે.
 મહાન્મા આગળ વધતા મથ છે... વધતા મથ-
 છે... વધતા મથ છે... એકે મકાન એવું મળે
 છે જ્યાં વિભ્રતીય દેખાય નહિ, સંભળાય નહિ,
 આવી કોઈ બખર, આવી કોઈ દુકાન, આયુ
 કરું પણ વ્યાં નથી. ફક્ત એ મકાન છે એ
 મકાનની અંદર, અથવા એની નજીક ના -
 ભાગમાં, ક્યાંક અગ્નિ કર્મ થઈ રહ્યું છે.
 FOR EXAMPLE આજની ભાષામાં વૈલ્ડીંગ !
 આયું કોઈકે કામ થઈ રહ્યું છે. વિભ્રતીય નથી.
 એવું પણ નથી સાધુની ઉપધિ બની મથ,
 આગ લાગી મથ, આવી કોઈ જ સંભાવના -
 નથી. એવા મકાનમાં ઉતરવું ફી ન ઉતરવું,
 આચારોગ સુત્રમાં સુધર્મ સ્થામી ભગવાન -
 જવાબ આપે છે, કે એવા મકાનમાં ઉતરવું
 સાધુની કલ્પે નહિ. પ્રશ્ન ક્યો કે નીઉકાયની
 કોઈ સંઘટ્ટી થાય એમ નથી, વિરાધિના નથી,

ખાત્ર વિરાધના નથી, સયમ વિરાધના નથી,
 પ્રવચન વિરાધના પણ નથી, કોઈ વીભક્તની -
 અપભ્રાજના થાય એવું પણ નિમિત્ત નથી, કે -
 આવી જગ્યાએ કેમ ઉતર્યા જ્યાં પોલીંગ થાય છે.
 તો પછી એવા મકામમાં શા માટે ન ઉતર્યું ?
 અને આચાર્ય સુત્રની અંદર જવાબ આપ્યો કે,
 સાધુ છે એમની ઘડી ઘડી એ દ્રશ્ય દેખાય,
 અને દ્રશ્ય દેખાવા ના કારણે, સાધુના મનમાં -
 સફળ રીતે એવો વિચાર આવે,

કવં કવં કુજ્જા ।

એ હવે આ રીતે કરે, આ રીતે કરે દિવાળી -
 માં ફટાકડા ફુટના હોય, આયુ કોઈ અગ્નિકર્મ
 થતું હોય. એ સાધુથી જોવાય નહિ, અને
 જ્યાંથી એ દેખાય ત્યાં સાધુએ ઉતરાય નહિ.
 ભગવાન ઢીલી ઢીલી વાન કસતા જ નથી,
 કે ભાઈ મનને વાળએ, બહુ વેરાગ્ય કોળવએ,
 બહુ એનો પ્રતિપત્તી વિચાર કરએ, મનને એક -
 દમ સત્ય ફીરેવી ને પાધુ વાળએ, બસ હવે
 મારે નથી જ મોયું, નથી જ મોયું, નથી જ
 મોયું મથી જ મોયું, ભગવાન ચુપની દશા -
 સમઠે છે. જડને સલાંક વ્યવસ્થા, સજ્જ -

વિવસ્થા, સૌ ટકા ગુવનો બચાવ, સૌ ટકા-
પરિહાનિ ની સુરક્ષા, એ ત્યારે સંભવી શકી,
જ્યારે એ ગુવ, એવી જગ્યાએ જય જ નહિ,
ને ત્યાં ઉતરે જ નહિ.

સેનાની પ્રશ્ન :- સાધુઓ સવારે વહેલા -
વિહાર કરીને પહોંચે, અને
આપણી તો દસ વાગે ઘંઘી કરવા જતા હોય,
તો પછી પુછવાનું કોઈ રીતે હો અને વિખતીય
પાગ ચોવીસ કલાક બારીમાં જ ઉભુ હોય -
એવો તો કોઈ નિયમ નથી જ, તો સાધુ
પૈલા લાઈને પુછે કે શરૂઆત વિખતીય છે કે
નહિ, તો આ બધી વ્યવસ્થા કઈ રીતે ગોઠ-
વાતી હશે, સવારના વહેલા સાત વાગ્યામાં ?

વૃજ્યશ્રીનો ઉત્તર :- જેન વિધિ મુજબ,
સાધુ કોઈ પણ જગ્યાએ -
એમ ને એમ જય નહિ. માસકલ્પ માટે એક -
જગ્યાએ રહ્યા, માસ કલ્પ પુરો થવા આવ્યા છે,
એ દિવસોની અંદર, ગતિાર્થ, વૃક્ષલ્પ, સ્થાવિર
મહાશ્વેતાશી, વચથી પરિહાન, મૃતથી પરિહાન,

એવા મહાત્માઓ જે અત્યંત સંયત્રમાં સ્થિર છે,
 એવા મહાત્માઓ ઝોત્ર પ્રતિપ્રેરણા માટે અપ.
 ઝોત્ર પ્રતિપ્રેરણા એટલે ફેલે નો માસ કલ્પ ક્યાં
 કરવા, એના માટે યોગ્ય ઝોત્ર શોધવું. બાળ,
 વૃદ્ધ, અપરિણત, અગીતાર્થ, નાના સાધુઓ,
 નુનન હોતીત સાધુઓ, આ બધાને લઈને -
 સીધા કોઈ ગામમાં પહોંચી જ્યું, આપું શાસ્ત્રીય
 વિધાન નથી. પહેલા આવા મહાત્માઓને -
 મોકલવામાં આવે, જરૂર પડે તો ચાર દિશાના -
 ચાર ગામોમાં મોકલવામાં આવે. પાછા આવે,
 અને તેઓ બધી REPORT આપે. તેઓ એ
 વ્યાં વહેવાનું, તેઓ એ વ્યાં મંગ દાઈમ -
 ગોધરી જ્યાનું. શાસ્ત્રમાં કહ્યું તપસ્વીને નાહું
 મોકલવાના, અનેને ખબર ના પડે કે ઝોત્ર -
 કોવું છે. આવા ઘણા બધા મુદ્દાઓ બતાવ્યા.
 અને તેઓ બધી જ રીતે ઝોત્રને મેઈ લી,
 સંયત્ર અનુકૂળ છે કે નહિ, મહાત્મા -
 માંદા પડે તો સચવાય એમ છે કે નહિ, કોઈને
 નવકારથી પગ ફોવે ગરહમાં. મંગ દાઈમ -
 ગોધરી મળે છે કે નહિ, આપું કોઈ -
 શીબ પ્રતિબદ્ધ, રૂપ પ્રતિબદ્ધ, વસ્તિ તો નથી

ને આ બધું જ એ મોઈ લે, પછી આવીને
 REPORT આપે, પછી આચાર્ય ભગવંત, જે
 જુદી જુદી દુકાઓ ગઈ ફાયે, એના REPORT
 ના આધારે, જે ઊંત્રની અંદર સંયમની સુરક્ષા
 વધારે ફાયે, એ ઊંત્રમાં જવાની નિર્ભય કરે,
 ને માસકલ્પ પુરો પાય, અને મહાત્માઓ વિહાર
 કરીને ત્યાં મય.

૧૧/સ્ત્રોમાં ત્યાં સુધી બતાવ્યું,
 કે એ રસ્તા ફાયે ને ત્યાં વચ્ચે-વચ્ચે જે
 ઊંત્ર પ્રતિપ્રેક્ષણ કરી આવ્યા એ મહાત્માઓ-
 ઉભા રહે, બાળ, ગલાન, વૃદ્ધ, તપસ્વી વગેરેથી
 રહેલી ગરબ, એના મહાત્માઓ, એમની ક્યાંક
 બાધા ટાળવા જ્યું ફાયે, લઘુશકા. વડી શકા-
 તો ક્યાં કરી શકાય. એનું માર્ગ દર્શન એ-
 મહાત્માઓ આપે. ઇંચુ આગળ વધીને, ઊંત્ર-
 પાંડું ફરે છે, વચ્ચે બે-ત્રણ જગ્યાએ STOP
 વધું પડે એમ છે, તો એ ગાત્રની અંદર-
 પાન, ક્યાં ઉતર્યું, ક્યાં ગાયેરી વાપરવી,
 બધાની ડેવી વ્યવસ્થા પાય, આ બધું જ
 ઊંત્ર પ્રત્યુપ્રેક્ષક મહાત્માઓ એ બરાબર મોઈ લે,

ને આખું PLANNING થયા પછી, ગરબના વિહાર થાય.

તત્કથાશ્રવણમ્ ।

સામાનો પ્રશ્ન :- ભગવંતે ! જ્યાં ઉપાસ્યત્રી ઉતર્યા હોઈએ તો ત્યાં નીચે પાણી ઉડાવું હોય તો ત્યાં કઈ રીતે કરાય ?

પ્રશ્નશીનો ઉત્તર :- સ્વેળ વિધિ મુજબ, જે મકાનની અંદર, આવું કંઈ-પણ હોય, જ્યાં કંઈ પણ પ્રકારે, ધાર્મિક કે બિન ધાર્મિક, પ્રયાજનથી પણ વિચિત્રતાનું વધારે સમ્રથ રહેવા પાડું હોય, જ્યાં રસોડો હોય, જ્યાં રસોઈઓ થતી હોય, આવું બીજું કંઈ-પણ હોય, સ્વેળ વિધિ મુજબ, સાધુથી ત્યાં ઉતરાય નહિ. હવે આગળ વધાને, જ્યાં અનાજની ગુણો પડી હોય, જ્યાં કાચા અનાજની ગુણો સુલ્લા પડી છે, એવા પણ મકાનની અંદર, સાધુથી ઉત્સર્ગથી ઉતરાય નહિ. ભગવાને જે વ્યવસ્થા કરી છે તે અત્યંત સચ્ચ છે. જ્યાં સાધુની પરિભ્રમણ ની રસા, જ થાય,

સૌથી ન બની, સૌથી વ્યવસ્થા લગવાની આવી છે.
 અને જ્યાં જ્યાં સત્રો કંઈ પણ છુટછાર લેવાની
 આવી છે, ત્યાં કંઈને કંઈ નુકસાન પ્રાયઃ કરી
 ની, કમ સે કમ પરિહાનિ ઊત્રે થવું હોય,
 સૌથી સંભાવના વધારે છે. બહુ મનીમંચન
 કરીએ, બહુ વિચારીએ, જેટલી જિજ્ઞાસનામાં,
 સંઘમાં, સાધુ સંસ્થામાં, પ્રાવકોમાં, સત્રસ્થા-
 સૌનું સર્જન થયું છે, ક્યાંક ની ક્યાંક -
 આપણે,

ભગવાનની આજ્ઞાથી આધાપાછા થયા હોએ

અને બધી સત્રસ્થાસૌનું સત્રાધાન શોધવા, કોંકો
 મારીએ હોએ, વિચારણા કરીએ હોએ, ત્યારે
 પ્રાયઃ કરીને આપણે ધીગડા મારવાનું વિચારતા
 હોઈએ હોએ. કરવાની જરૂર આટલી જ છે,
 મુળ માર્ગમાં આવી જઈએ, મુળ વિધિઓ,
 શાસ્ત્રની આજ્ઞા, ભગવાનનું વચન, અને
 PATORITY BASIS ઉપર આદર થાય,
 જેવું POSSIBLE હોય અટલું, આજ્ઞા કાળ
 ની અનુરૂપ, આજ્ઞાની શક્યતાઓ ની અનુરૂપ,

એ ઠેરનું એમાં આવશું, એટલું નક્કર સત્રા-
ધાન મળશે, બાકી ગાંધી તોલના ફાંફા મારશું,
ડંઈ ને ડંઈ, ડંઈ ને ડંઈ તકલીફો રહીવાની-
જ છે.

આને સાર્વાત્રિક એવી પરિસ્થિતિ
વર્ધ ગઈ, આ બધી વાતો સાંભળીને પાગ-
આશ્ચર્ય થાય. અને અમુક વસ્તુઓ ના હોયે
ની સંઘ અધુરો કહેવાય, ને શાસ્ત્ર દ્રષિટએ,
સંયમ દ્રષિટએ, સત્રાગની ચર્ચા, અને સત્રાગ-
ની પરિગતિ ની દ્રષિટએ, એ વસ્તુ ના હોયે.
સંઘમાં કુવુ દસ વસ્તુ આવે તો વાંધો નથી,
પાગ સત્રાગની વચિત, સત્રાગનું આશ્રય-
સ્થાન, એ કોવું કોવું જોઈએ અનેા માટે
શાસ્ત્ર શું કહે છે જ્યાં સુધી આ દ્રષિટ
આવી નથી, અને આટલુ -- આટલુ UNDER
ONE ROOF આવી ગયું, અને એનાથી આપાગ
બહુ આગળ વધી ગયા, વિકાસ વર્ધ ગયા, શાર
ચર્ચો સંઘ ત્યારે તો ન હતું, પાગ આટલુ આટલુ
અમારે વર્ધ ગયું, અનેા અમને સંતોષ છે, કું
કું છું, સંતોષ નો પાગ વાંધો નથી. બહુ જ
MULTI PURPOSE ઉપાશ્રય હોયે એદર ધર્મશાળા પાત્ર

બનાવી હો. ભક્તિશાળા બનાવી હો. આયોજિત -
 ખાતુ બનાવી હો. સ્ત્રી ઘણી બધી વસ્તુ સંદર
 બનાવી હો, હૃદય નવુ નવુ નીકળ્યા કરે છે ક્યાંક
 કોઈક આરોગ્ય કોન્સે નીકળે છે, કોઈ ચિકિત્સા -
 કોન્સે નીકળે છે, આયુ ગમે તોરલું બનાવી, કંઈ
 સંઘની ભક્તિ સ્વરૂપે હૃદય, સંઘની આરાધનાના -
 આલંબન સ્વરૂપે હૃદય, તો ખોટું પણ નથી.
 પણ એટલું જ મેં મેં આવી, કે ભગવાને કહેલી
 મહાત્માની વસ્તિ એમાં જે ના હોયું મેં મેં,
 સ્ત્રી રીતે આપણે ઉપાસ્ય ના રાખીએ.

મેં મહાત્મા એમણે ક્યાં ઉતર્યું, ક્યાં
 ન ઉતર્યું, એના માટે ભગવાને શું કહ્યું છે,
 અને નવી ઉપાસ્ય બનાવતા, નવા PLAN માં -
 નવા મકાનમાં પણ આપણે રાહી વિસ્તાર છે,
 એક મકાનમાં જેટલું આવે એટલું સમાવી હો.
 જગ્યા મીઠી છે, બીજી-ત્રીજી ઘાય એમ નથી.
 અહિંયા જેટલું ઘાય એટલું કરી લો, ચાર માળ --
 પાંચ માળ -- છ માળ -- સાત માળ -- અને
 નવા નવા આવા ઉપાસ્યો બનતા અમ, શાસ્ત્રીય
 ટ્રીપ્લર એ ધારીકે • યૌધા આરાના મહાત્માઓ,

એ અહિંયા એદ્રેશ્ય રૂપે પણ આવ્યા હોય ,
 ગમે તોરલા સંયમી પણ મહાત્માઓ હોય , અમને
 આવા મહાનો મોઈ ને અમને પહીલી શંકા પડી,
 કે આ કૌવા પ્રકારના મહાત્મા કહીવાય કે અહિંયા
 ઉતર્યા છે. વાત સમજાઈ છે

બીજું બધું લાવો કોઈ વાંધો નથી ,
 અને એરલું બધું લાવવું જ હોય અને કોઈ-
 છુટકો જ ના હોય , તો પછી એરલું કામ -
 કરવું મોઈએ કે પછી વ્યાંચી ઉપામય કાઠી -
 નાખવી મોઈએ.

છગને પીન્ટ સીવડાવવા આવ્યું ,
 લાગ્યું કે કપડું વધશે, તો દરખુને કહ્યું કે -
 આમાંથી ~~સરસ~~ સરસ મજની ચોલી બનાવી દેએ,
 દરખુ કહે લલે. છગન ઘરે આવ્યા ને ચીને -
 ના પડ્યું ને ફરી પૂછીશ્યા દરખુ પાસે, ચોલી
 આવી હોવી મોઈએ ને, DOUBLE સિલાઈ -
 કરએ ને ચોલીનું HANDLE આવું હોવું મોઈએ,
 નીચેથી ચોલી આવી કરએ, દરખુ કહે લલે.
 ધણી જમીને છગનને વિચાર આવ્યા, છગન

દરમ્યાન પાસે પહોંચી ગયા, ચોલીનું આગ્ર કરમ્બે,
 નેત્ર કરમ્બે, ફાલાનું કરમ્બે, ઢીડળું કરમ્બે, દરમ્યાન
 કહી બલે. વળી સાંઠે છાન લગાર લગાડી આપ્યા,
 દરમ્યાન એ સાંઠે થી પુછ્યું બોલો ચોલી નું શું
 કરવાનું છે, છાને કહ્યું આપુ આપુ કરવાનું છે.
 સમય આપ્યા ફરી ત્યારે છાન પહોંચી ગયા,
 ચોલી એઈને રાગની રીડ ચર્ષ ગયા, જેથી ઈરલા
 ફની એવી ચોલી બની ગઈ હતી, અને પેન્ટ -
 મેયું તો છાન છડકડ ખર્ષ ગયા, પેન્ટ પફેરવા -
 જેવું જ ન હતું રહ્યું. છાને કહ્યું આ શું છે,
 દરમ્યાન એ કહ્યું કે તમને ચોલી ની વધારે પડી
 હતી, એના ઉપર વધારે ધ્યાન આપ્યું, જે -
 બચ્યું એમાંથી પેન્ટ બનાવી દીધું. તો -
 PRIORITY ચોલી ની હતી, કે PRIORITY
 પેન્ટની હતી હો, અને PRIORITY એ ચોલીની
 વર્ષે મય છે તો પેન્ટનું શું વર્ષી હો

ઉપામય એ એક SAMPLE છે,
 કોઈ સંઘની વાત નથી, કોઈના માથે માહલા
 ઘોષા જતા નહિ. આ આપણા બધાની જ વાત
 છે. અને એ જ પ્રશ્ન પુછવા જેવો છે કે મારા

ઇદ્યત્રાં અને તમારા ઇદ્યત્રાં લગવાનની આજ્ઞાનું
 બહુમાન કૈલુનું છે તે સંયમ પરિભાગિનું મુલ્ય -
 અપાગા મનત્રાં કૈલુનું છે તે મને ધાર કથા -
 સૌથી ચીમાસાની વિનંતી છે. એક કોંગે છે જ્યાં
 સંયમનું પાલન સારાત્રાં સારુ થાય એમ છે. -
 યાજ્ઞાનત્રાં લોકી સૌહાર્દ-વત્તા આવે એમ છે. કંઈક
 મારે શાસનનું કાર્ય કરાવ્યું છે, પૈસા સૌહાર્દ-વત્તા
 મળે એમ છે. X P Z આવું કંઈક થાય એમ
 છે, સંયમનું પાલન સારુ થાય એમ છે. બીજા
 એમ છે જ્યાં આ બધા અતમતના, વસ્તીના,
 સંયમ પરિભાગિ સાથવવાના PROBLEMS છે,
 હું ક્યું એમ પસંદ કરું છું તે નમ્રે આવું
 બનાવી દીધું, તમે જ ગુનેગાર ને આવું કરાય
 જ નહિ, ને આમ છે ને તમે છે, સૌથી ગમે -
 તેથી વાતો હું કરું. મને જ એ સંયમ પરિભાગિનું
 મુલ્ય નથી, મારા જ ડ્રિફ્ટ સંયમને ગીલા કરે છે
 ને બીજા FACTORS ને પ્રધાન કરે છે, તો
 હકીકતમાં હું જ સમજ્યાં નથી.

તત્કથાપ્રવણમ્ ।

હરીભદ્રસુરી મહારાજ કહે છે, સૌથી કથાએ -
 જવાય તો નહિ, જ્યાં અગ્નિ કર્મ છે, જ્યાં -

વિજ્ઞાતીય ના દર્શન, સ્વયંગ હૈ, જ્યાં કોઈ અવા
 વીપાર - દેધાની વાત હૈ, જ્યાં કોઈ સાંસારિક -
 પળોજગ હૈ, અવી જ્યાઅ જ્યાય તૈ નહિ,
 અવી જ્યાની વાત સુધ્ધા સંભળાય નહિ.
 મોજાઈલ ખીસ્મામાં રાજવૈ હૈ, મોજાઈલ હોડવૈ
 નથી, અને જળાપૌ પગ કરૈ, પસ્તાવૌ પગ -
 કરૈ, કૈ આરલુ ખોડું થઈ અય હૈ, જહુ ઇરહીઅ
 હીઅ નથી હોડાનું, નિયત્ર લઈઅ હીઅ,
 ઠીકાણું પડનું નથી. જહુ સીધૌ- સીધૌ પ્રશ્ન -
 આપણને લગવાન કરૈ હૈ, તમારૈ આમાંથી
 જયવું હૈ કૈ નહિ આરલુ જોલૌ હૈ જયવું
 ફીચ તૈ સાધન હોડી હૈ, અને જે COST
 ચુકવવી પડે અ ચુકવી હૈ, અને નથી હોડવું
 તૈ સીધું જોલૌ કૈ અમારૈ નથી હોડવું.
 રાજવું અ હૈ, જયવું અ હૈ, આ જહી હૈ ન
 સમમથ નહિ અવી વાતૌ હૈ. અને કદાચ
 તમે ન હતી સમમથ, ન હતી આવી ખ્યાલ,
 તમે રાજ્યું, તમને અનુભવ થયૌ કૈ જાઈ
 આપણે, આમાં ફાવતા નથી, થતતા નથી,
 ફાસ્તા જ જઈઅ હીઅ, માર જ ખાતા જઈઅ
 હીઅ. ઇતા તમે રાજૌ હૈ, અને સીધૌ અર્થ

એ છે, કે તમને બચવાની ઈચ્છા સુધ્ધા નથી.
અને આપણે કહીએ કે ના, બચવું તો છે, એનો
અર્થ એ છે કે આપણે આપણને ઈતરીએ -
છીએ.

મેહાત્મા જે બિલ્ડીંગમાં ગાયરી એ
ગયા, મહાત્મા ને ખ્યાલ આવ્યો, કે અહિંયા -
મયાદા - સભ્યતા બરાબર છે નહિ. અહિંયા -
ઇસ્તુ વાતાવરણ બરાબર છે નહિ. અહિંયા, આ
બિલ્ડીંગમાં ખાસ સંયત્ર પરિગતિ, જે સચવાય
એવી શક્યતા સૌથી છે. અને મહાત્મા એ
બિલ્ડીંગ જે હોડી છે એટલું જે નહિ એ વિસ્તાર
સુધ્ધા ન હોડી છે, તો એનો અર્થ એ છે કે
મહાત્માને પાતાની જે પરિગતિ ની ચિંતા નથી.

તત્કથાપ્રવણમ્

લગવાન આગળની વાત કરે છે જવાની વાત
કરે છે, એવાની વાત કરે છે, તમે એના વિષયની
વાત સાંભળવાનું સુધ્ધા હોડી છે. અને એના-
માટે લગવાને કહ્યું, દસ વૈકાલિક આગ્રનું સ્પષ્ટ
કેરમાન છે.

જિહી અંથતે જ કુજ્જા.

તમે ગૃહસ્થોની સંપર્ક જ ના કરો સંસર્ગ જ ના કરો પરિચય જ ના કરો એ જીસશોને તમે એમને શીશનો સમજવશો કે અમારે. આ સંભળાય, આ ન સંભળાય, આ સંભળાય આ ન સંભળાય, આ સંભળાય, આ ન - સંભળાય, તો એ ક્યાંક કંઈને કંઈ આવી જશો અને તમે ફરિયાદ જશો તમારી પરિભાગિ કદાચ દિવસોથી, મહિનાઓથી, વર્ષોથી, તમે છાંતી, દસ ત્રિનિરનો એવો કોઈ સંસર્ગ, એવી કોઈ વાત, એમાં થયેલી પરિભાગિ ની ડહોળામગ- એમાં કોઈ ખાલેલી સાંસારીક વિકલ્પ, અને એ પરિભાગિ એમાં યુગાઈ જતી હોય, આવી જ્યાં સંભાવના હોય, આપુ એજમ તમે શા માટે લો છો ?

ગિદી સંથવે જ કુજ્જા કુજ્જા સાહુહિ સંથવે ॥

તમે ગૃહસ્થનો પરિચય કરતા નહિ, તમે સાધુની પરિચય કરમી.

તેલાનો પ્રશ્ન :- ગૃહસ્થને સાધુ ની પરિચય કલ્યાણમિત્ર તરીકે કરવાનું કહ્યું અને આપ ગૃહસ્થનો પરિચય કરવાની ના પાડો છો

એ કઈ રીતે જંધે જીસાડયું ખતારે ?

પૂજ્યશ્રીના ઉત્તર :- તમારી વાત બરાબર છે, એ કલ્યાણમિત્ર ક્રીડા અને એ જે પોતે દીર્ઘ સંયમ પધાયેથી, વિશિષ્ટ-મુત અભ્યાસથી, ગીતાર્થતા કે વિશિષ્ટ-સંવિનતાથી, ઉન્મુત્ત પરિહારપુર્વક ધર્મ ક્ષાત્રાં-જે પ્રવિણ હોય. જેને ગુરુ સિક્કા મારી આપે કે હા તમે ધર્મ ક્ષા કરો. એ આ રીતે-મુદ્ધસ્થનું કલ્યાણ કરી શકો. અને દરેક મે આ કરવા મય, અને એમાં પોતાના આત્માનું-બગાડનું હોય, તો ભગવાન એની ના પાડે છે. અપ્પહિત્ત પરહિત્તણં અપ્પહિત્તં એવ કાયવ્વે ।

મહાનિશિષ્ય મુત્ત ના શબ્દો છે, પોતાનું હિત ધાય કે તમારું હિત ધાય, જ્યારે આવી SITUATION છે ત્યારે તમે તમારા આત્માનું જ હિત કરમ પોતાનું બગાડીને બીજાને સુધારવા જતા નહિ. અને અગીતાર્થ મહાત્મા, કદાચ એમ થઈ-મય કે આવી સ્થાઈ ના વિચારથી, બીજાનું ભલું તો ધાય જ છે ને મારું જે થતું હોય તે ધાય, પણ અગીતાર્થ મહાત્માને શાસ્ત્રને

જિરાબર સમ્રજ્યા નથી ને આજ્ઞામાં પાતે
 પ્રતિબદ્ધ નથી, એ બધું સાચુ જ સમ્રજ્ય,
 ઉચિત જ સમ્રજ્ય, દ્રેવ્ય, મેત્ર, ક્ષમા, લ્યાવ,
 યોગ્ય જ સમ્રજ્ય, અને એ આત્માનું દિલ-
 ઘાય એવું જ સમ્રજ્ય, એ પાતે જરૂરી નથી.

ગીતાર્થ જ પાતાનો પાતે ઉદ્ધાર
 કરી શકી, બીજાની પાતે ઉદ્ધાર કરી શકી. -
 એગીતાર્થ બીજા ને ય કુબાડી, પાતાને કુબાડી,
 લ્યાવ સારી હોય, પાતે કૌસ અભ્યાસ ના હોય,
 પ્રશ્નપાત્રાની અંદર ગરબડ પછી મય. સાવધ્ય-
 બીલાઈ મય, અનુચિત બીલાઈ મય, શાસ્ત્રીય
 વાત પાતે, દ્રેવ્યાદિ સાપેક્ષ ના હોય એ રીતે
 બીલાય મય, વ્યારે પાતાનું અને બીજાનું બગાડવું
 હોય છે.

શ્રીભદ્રેશ્વરી મહારાજ ધર્મ-બિંદુ
 ગ્રંથમાં આગળ વધી છે, સુત્ર નંબર પંદર,
 અશક્તલિષ્ટતા।

તમને એવા સ્થાને જવાની ના પાડી, તમને
 એવા સ્થાનની વાત સાંભળવાની ના પાડી,

હવે શું કરવાનું ? હવે બિનધારત, હવે જે
 કરવું હોય એ કરો, હવે તમે બધી ગયા, હવે
 તમે છુટી ગયા, હવે તો કોઈ વાંધો જ નથી.
 એવું નહિ.

અસ્ક્તદ્વિષ્ટતા।

તમે કોઈ પણ જાગે રાગ કે ક્રોધ કરતા નહિ.
 મુનિચંદ્રસૂરી મહારામ ટીકાની અંદર લખે છે,
 રાગ-ક્રોધો યદિ સ્યાતાં તવસ્મા કિં પ્રયોજનમ્।
 મે તમારી અંદર રાગ છે, મે તમારી અંદર-
 ક્રોધ છે. તો પછી તપનું તમને કામ શું છે !
 તપ તો તમને કાયદો શું છે ? તપ ના ઘણા-
 બધા અર્થ છે, તપનો એક અર્થ ધાય છે
 દીક્ષા. તપનો એક અર્થ ધાય છે સાધના.
 તપનો એક અર્થ ધાય છે ઉપરધર્મ. તપનો-
 એક અર્થ ધાય છે જ્ઞાતાપના ગ્રહણ. તપનો
 એક અર્થ ધાય છે, પરિવહુ અને ઉપસર્ગ ને
 સ્તહન કરવા, તપનો એક અર્થ ધાય છે
 ઉપવાસાદિ કરવા. અહિંયા બધા જ અર્થો
 લેવાના છે. મે રાગ ક્રોધ છે, તો પછી
 તપનું શું કામ ? જહુ સરસ મંત્રની વાત આ
 સ્લોકમાં કહી મે રાગ-ક્રોધ છે, તો તપ તમારા-

માટે નિબંધ છે. બધું જ શેના માટે છે, વિતરાગ થવા માટે. રાગ-દ્રેષ છોડવા માટે, અને મેં રાગ-દ્રેષ છે, તો એનો અર્થ છે કે તપ નિબંધ છે. મેં આનો અર્થ એ નથી કે તપ છોડી દેવો. આનો અર્થ એ છે કે તમે બધાં સંસાર છોડ્યા, વિક્ષયાં છોડ્યા, રાગ-દ્રેષના નિમિત્તાં તમે છોડ્યા, અને કૃપે તમે રાગ-દ્રેષ પણ છોડી, જેનાથી તમારું આ બધું સફળ થાય.

૧૧/૨૩૦ માં મય વાક્ય હોય છે, એ વાક્ય સંયમને વધારે નિર્મળ બનાવવા માટે છે, સંયમની ભાવના છોડવા માટે કે સંયમ છોડવા માટે નથી.

સેલ્વાની પ્રશ્ન :- પહેલા તપ કરો, વિગઈ નો વ્યાગ કરો તો ભાવ નિર્મળ બને આપ સ્ત્રી કહો છો કે કે કે રાગ-દ્રેષ છોડો તો ભાવ નિર્મળ બને.

૫૪૫૩ની ઉત્તર :- જેટલું આ છે તે વ્યક્તિએ નિશ્ચય નું COMBINATION

સમજાવે તેમાં તર સત્રાંતર રીતે થાલે છે. ગુરુ-
 વિચિત્ર તત્ત્વવિનિશ્ચય ગ્રંથમાં મહોપાધ્યાય યશી -
 વિજયવ્ય મહારાજ બહુ સ્પષ્ટ કરે છે.

(ગિચ્છયવવટારણં સરુવં અવ્વણ્ણસમખ્ણવિહું ૩ ।

તમે કરો કે નિશ્ચય જ સાચો ની નિશ્ચયથી
 વ્યહવાર આવશે, માટે નિશ્ચય સાચો, અથવા
 નિશ્ચયથી વ્યહવાર સાચો પડે માટે નિશ્ચય -
 સાચો, એકાંતે આ વાત કરો તો જી વાત પળ
 ખોટી છે. તમે કરો વ્યહવાર જ સાચો, ક્રિયાથી
 જ ભાવ આવશે, પહેલા ક્રિયા કરો પછી -
 પરિણામ આવશે, પહેલા સ્થાન ઠાકો પછી -
 પરિણામ આવશે, એકાંતે તમે આરભું પડકારું.
 અને બીજા FACTORS ઉપર તમારી કોઈ ક્રિયો
 નથી તો, એ મન પળ ખોટી છે. મહોપાધ્યાય
 યશીવિજયવ્ય મહારાજ કરે છે, કોઈ પળ સાચો
 નિશ્ચય, એ વ્યહવાર વગરનો હોતો નથી.
 અને કોઈપણ સાચો વ્યહવાર એ નિશ્ચય -
 વગરનો હોતો નથી. વ્યહવાર અને નિશ્ચય -
 કરી પળ જુદા જુદા હોતા નથી, તમે પ્રતિષ્ઠાગ્ર
 કરી રહ્યા છો, ક્રિયા છે, ક્રિયામાં જે ભાવ છે,
 સંભાવ છે, ઉપયોગ છે, એટલા એથી એમાં પળ

નિશ્ચય છે. તમે સ્વાહ્યાય કરી રહ્યા છો, દયાન કરી રહ્યા છો, એમાં મુદ્રા વગેરે, ઉચ્ચાર વગેરે જે ક્રિયા છે, એટલા અંશ એની અંદર પણ વ્યક્તિય છે. એટલે બંને જી છુટા પાડીને તો કદી મીળવી શકાય એમ નથી. અને બંને છુટા ફાળે શકે એવી પણ સંભાવના નથી.

અશક્તદ્રિષ્ટતા ।

હરીભદ્રસૂરી મહારાજ કહી છે, તમારા પરિગામની તમે ઝાંઝા ઝાંઝા કાળુ કરી સાચો સાધક એ છે, જેનું સર્વોત્કૃષ્ટ સપનું વર્તમાન ઝાંઝાની - અપેક્ષા એ છે કે મારે મારા ભાવ બગાડવા નથી. પરિસ્થિતિ ચાહું ગમે તેવી છે, સામે કદાચ અન્યાય થયો છે, સામે વાળાની ભુલ-પાલ છે. સુધારવા જતા આપણા પરિગામ - બગડે એમ છે,

અશક્તદ્રિષ્ટતા ।

સાચો સાધક એ છે, રાગની ભાવ જગીને આમ દાનુ ગયા ફાળે એવું ભાગી. ક્રોધની ભાવ જગી અને આમ દમડી જે એવું ભાગી. અગ્નિ ભુલમાં પણ અડાઈ ગયા તો ભાગસ કીધી રીતે ફાળે પાછો ખેંચી લી, એ રીતે જી શાગ-ક્રોધના

માનસિક વિકલ્પથી પણ પાછી ફરી અથ ,
એનું નામ સાચી સાધુ !

સેલાનો પ્રશ્ન :- સૌજન્ય આપી કહ્યું કે
જ્યન્ય થી શુવી ત્રણ પ્રકારના
હોય, કૃવે અમ્ને મધ્યમ શુવી છીએ તી અમારે
વધારે વ્યકુવાર તરફ ઢળી જ્યું, કે નિશ્ચય
તરફ ઢળી જ્યું છે

વૃજ્યમીની ઉત્તર :- એક ઉદાહરણ તમને
આપુ, તમે કહ્યું કે અમ્ને
બધા મધ્યમ શુવી જ છીએ, એક ઉદાહરણ
લઈએ કે અહિંયા સીવી વક્તિ છે કે જ્યાંથી
સંયમ શુદ્ધિ સચવાય એવા પ્રેરથી દેખાતા
જ નથી. અને એવી વક્તિ ને છોડીને મહાત્મા
નિર્દોષ મહાનની પ્રત્યે જઈ રહ્યા છે, આ વ્યકુવાર
કે નિશ્ચય છે હું તમને પુછુ છું, વ્યકુવાર !
દેખીતી દ્રષ્ટિએ ચાલવાની ક્રિયા છે, વ્યકુવાર છે,
પણ અમાં ને જિનાજા નું બહુમાન છે, આજ્ઞા
પાલનની ભાવ છે, પરિભ્રમિ ની પડપાન છે.
મારે લગવાનની આજ્ઞા તોડવી જ નથી,

આપો જે મનોવધ છે, એનો યથાશક્તિ પુરુષાર્થ
 છે, આ નિશ્ચય છે. એટલે કવિ વ્યક્તિઓમાં જ્યુ
 ડી નિશ્ચયમાં જ્યુ આ પ્રયત્ન જ ખીટો છે. જે -
 ફરી એ બંને ફરી, યા એકે નહિ ફરિ, યા -
 બંને સાથે ફરી. તમે ભગવાનની આજ્ઞાની -
 દિશામાં ભવ છો તો બંને છે, તમે વિરુદ્ધ -
 ભવ છો તો એકે નથી.

કેવલ પ્રેમથી મહારાજ આગળ વધ
 છે, અને સમય થયો છે, અને આરંભ રાખી.

x x x x x